



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩

કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦



તા.૨૧/૦૮/૨૦૧૮ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૮૪૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૬ કેસ કરી, ૬૮ વ્યક્તિઓને ઝડપી, ૨૮૫ લીટર દેશી દારૂ, ૧૫૫૧ બોટલ ઈંગ્લીશ દારૂ, ૫૪ બિયર ટીન અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૧૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૮,૫૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૮૪૨/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી ૯૩ મુજબ ૯ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપિંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૮૪૩/૧૮

વસ્ત્રાપુર: (૧) કનીકાબહેન ડો/ઓફ રાકેશભાઈ બંસલ (ઉ.વ.૨૮) (રહે. કોર્ણાક ટાવર નાલંદા કોમ્પલેક્ષ પાછળ માનસી સર્કલ સેટેલાઈટ) એ તા.૨૦/૮/૧૮ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે માહે જાન્યુઆરી ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૮ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી કુમાર પરશોતમદાસ વસવાણી (રહે.કપડવંજ જવાહરનગર સોસાયટી જીલ્લો-ખેડા) એ વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે કોર્ણાક ટાવર ખાતે ફર્નિચર આપવાના બહાને રૂપિયા ૮૪,૦૦૦/- રૂપિયા મેળવી લઈ ફર્નિચર નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.જે.રાણા ચલાવે છે.

(૨) અખીલેશ રામસિંહાસન યાદવ (ઉ.વ.૨૪) (રહે. હેબતપુર ગામ તા-દસકોઇ જી-અમદાવાદ) એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૦૮/૧૮ સવારના ૧૧/૧૫ વાગ્યાના સુમારે એસ.જી.હાઇવે થલતેજ લેંડમાર્ક હોંડાની બાજુમા આવેલ એસ.બી.આઇ.બેન્ક ખાતે બે પુરૂષોએ અખીલેશ યાદવને વિશ્વાસમાં લઈ એ.ટી.એમ.મશીનમાં કેશ ડીપોઝીટ ઓન લાઈન ભરવાના બહાના હેઠળ રોકડ રૂપિયા ૧૩,૧૦૦/- અને મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૩૦૦૦/- લઈ જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.આર.ભરવાડ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૮૪૪/૧૮

વાસણા: મુકેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી (રહે.ચંદ્રનગર છ રસ્તા નીતા ફ્લેટ નંબર-૧ વાસણા) એ તા.૨૦/૯/૧૮ નારોજ વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૦૯/૧૮ રાતના ૧૧/૪૫ થી તા.૧૪/૯/૧૮ કલાક ૩/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી વીવો કંપનીના બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૧૪,૦૦૦/-, ડીવીડી પ્લેયર કિંમત રૂપિયા ૫૦૦/-, પિતળની ધાતુના ઘોડા નંગ-૨ કિંમત રૂપિયા ૧૦૦૦/-, પિતળના ધાતુના હાથી નંગ-૨ કિંમત રૂપિયા ૧૦૦૦/- અને રોકડ રૂપિયા ૬૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭૬,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.આર.સુર્યવંશી ચલાવે છે.

છઠ્ઠા માળેથી પડી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૮૪૫/૧૮

નીકોલ: મનોજભાઈ નાનજીભાઈ કુંજડીયા (ઉ.વ.૪૫)(રહે.સનરાઈઝ પાર્ક નીકોલ) તા.૧૯/૦૯/૧૮ સાંજના ૭/૩૦ વાગ્યાના સુમારે ગંગોત્રી સર્કલ પાસે આવેલ પારીજાય રેસીડન્સી નામની સાઇટના છઠ્ઠા માળે સીડીની બાજુમા આવેલ લીફ્ટની ખુલી જગ્યામા પગ લપસી જતા નીચે પટકાતા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે સીવીલ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોશ્રીએ મૃત જાહેર કર્યા હતા. આ અંગે નીકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી પ્રવીણભાઈ સાંજાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.